




રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારો દ્વારા
કેન્દ્રીયમંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાજીની રૂબરૂ મુલાકાત
લઈ ઈન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ના સેક્શન 43B(h) ના અમલ
અંગે ફેરવિચારણા કરવા અને હાલ મુલતવી રાખવા રજુઆત
કરવામાં આવી...



RAJKOT CHAMBER OF COMMERCE & INDUSTRY

હાલ સમગ્ર દેશમાં ઈન્કમેટેક્સ એક્ટ ૧૯૬૧ના સેક્શન 43B(h) ના અમલ અંગે ઘણી મુંઝવણો ઉભી થવા પામેલ છે. પ્રવર્તમાન ઈન્કમેટેક્સ એક્ટ ૧૯૬૧ના સેક્શન 43B(h) નો આગામી એપ્રિલ ૨૦૨૪ થી અમલ કરવામાં આવનાર છે. જે મુજબ નવી જોગવાઈ અંતર્ગત કોઈપણ ઔદ્યોગિક કે સેવાપ્રદાન કરતા ક્ષેત્રો પાસેથી મેળવેલ પ્રોડક્ટ અથવા સેવાના યોગ્ય ચુકવણી સબંધે MSMED એક્ટ મુજબ સ્પષ્ટ જોગવાઈ નિર્ધારિત કરાયેલ છે. જે કિસ્સામાં પેમેન્ટ બાબત સ્પષ્ટ એગ્રીમેન્ટ થયેલ હોય તેમાં ૪૫ દિવસ તથા એગ્રીમેન્ટ થયેલ ન હોય તો ૧૫ દિવસની સમય મર્યાદા નિર્ધારિત કરાયેલ છે. આ જોગવાઈ MSMED એક્ટના સેક્શન ૧૫ અંતર્ગત કરવામાં આવેલ છે. સદર સમય મર્યાદામાં પેમેન્ટ ન થયેલું હોય તો જે તે નાણાંકિય વર્ષમાં નહીં ચુકવાયેલ રકમ લેનાર વ્યક્તિની આવકમાં ગણવામાં આવશે અને જ્યારે વાસ્તવીક પેમેન્ટ કરવામાં આવે ત્યારે આ રકમ બાદ મળવાપાત્ર થશે.

રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય તેમજ લાખોની સંખ્યામાં MSME એકમો અને નિકાસકારો કાર્યરત છે ત્યારે આ જોગવાઈના અમલીકરણ દરમિયાન આવનારા દિવસોમાં તેઓને પડનારી મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ લાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા, કારોબારી સભ્યશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી અચ્યુતભાઈ જસાણી, EEPIC રાજકોટ ચેપ્ટરના કન્વીનરશ્રી સમીરભાઈ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખશ્રી જયભાઈ માવાણીએ કેન્દ્રીયમંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાજીની રૂબરૂ મુલાકાત લઈ નીચે મુજબની રજુઆત ધ્યાને મુકેલ.

(૧) નિકાસના તમામ વ્યવહારોમાં પારસ્પરીક વિશ્વાસ અને નિર્ભરતા પાયાની જરૂરીયાત છે. નાના નિકાસકારો ખાસ કરીને MSME હેઠળ આવતા ઉત્પાદન કરીને નિકાસ કરનાર એકમો સૌથી વધુ પ્રભાવીત થાય છે. કારણ કે, તેઓ કાચા માલની ખરીદી કરી, વસ્તુનું ઉત્પાદન કરી અને નિકાસ કરતા હોવાને કારણે તેઓના તમામ ખરીદી અને વેંચાણ સલગ્ન વ્યવહારો લેટર ઓફ ફેરડિટ હેઠળ વિવિધ સમય મર્યાદા નિશ્ચિત થયેલ હોવાને કારણે નવી પ્રસ્થાપીત ૪૫ અથવા ૬૦ દિવસની મર્યાદા તેઓ માટે બાધારૂપ સાબીત થયા છે. તદઉપરાંત વિવિધ ધંધાકીય વિસંગતતાઓ અને કેટલાક નકારાત્મક પરીબળોને કારણે એ લોકો પારસ્પરીક સમજૂતીથી જે કાંઈ સમય મર્યાદાને માન્ય રાખવી.

(૨) અનિવાર્ય સંજોગો જેમ કે, ગુણવત્તા વિષયક, જથ્થા વિષયક, નાણાંકિય પ્રવાહીતા વિગેરેના કિસ્સામાં નિશ્ચિત ૧૫ કે ૪૫ દિવસની સમય મર્યાદાનું પાલન ન થાય તેવા કિસ્સામાં કોઈપણ જાતની



RAJKOT CHAMBER OF COMMERCE & INDUSTRY

આર્થિક પેનલ્ટી લાગવી જોઈએ નહીં.

(૩) MSMED એક્ટમાં મોડી ચુકવણીના કિસ્સામાં વ્યાજનું પ્રોવીઝન કરવામાં આવેલ છે. આ બન્ને જોગવાઈઓને એકત્રીત કરવાથી એડવાન્સ ટેક્સની ગણતરી તથા ચુકવણીમાં વધારાનો બોજ પડશે.

(૪) એકમો દ્વારા તેમના કર્મચારીઓને ચુકવવામાં આવતા વેતન-ભથ્થા વિગેરેની ચુકવણીમાં ઘણો બધો વિલંબ થવા પામશે.

(૫) ઉપરોક્ત સુધારાનો મુળ હેતુ માઈક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રી તથા સેવા પ્રદાન કરતા ક્ષેત્રોને પોતાનું પેમેન્ટ નિશ્ચિત સમય મર્યાદામાં મળી રહે તે માટે શ્રેષ્ઠ પ્રયત્નોના ભાગરૂપે સદર કલોઝ જ ઇન્કમટેક્સ એક્ટમાં ઉમેરવામાં આવેલ છે. પરંતુ નાના યુનીટો કે જે ૫૦ અને ૧૦૦ લાખથી નીચેનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા હોય તેઓની ટેક્સ જવાબદારીને કારણે અન્ય નાણાંકીય અને વ્યવસ્થાકીય મુશ્કેલીઓ રહેશે.

(૬) ગેરકાયદેસર અને ગેરરીતી આચરનારોની સામે દંડાત્મક અને કડક કાર્યવાહી થવી જ જોઈએ તેવું અમારૂં સ્પષ્ટ માનવું છે. પરંતુ તેઓની સાથે સાથે નિર્દોષ અને સાચા વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ જાતની ખોટી મુશ્કેલીઓ ન ભોગવવી પડે તે પણ ખાસ ધ્યાને લેવું જોઈએ અને નિકાસકારોને હાલની ચુકવણીઓ અને વ્યવસાયીક સંબંધોનો લાભ યોગ્ય રીતે ચાલું રહે તે માટે નિકાસકારોને આ કાયદાના દાયરામાંથી બાકાત કરવા જોઈએ.

આમ ઉપરોક્ત તમામ સંજોગોને ધ્યાનમાં રાખી ઇન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ના સેક્શન 43B(h)નું પુનઃમુલ્યાંકન અને અભ્યાસ કરી નાના ઔદ્યોગીક એકમો, સેવા પ્રદાન કરનાર અને નિકાસકારોને પડનારી આર્થિક અને વ્યવસ્થાકીય મુશ્કેલીઓને ધ્યાને લઈ આ કાયદાના અમલ અંગે ફેર વિચારણા કરવા તથા યોગ્ય નિર્દેશ જારી કરી હાલ મુલતવી રાખવા ભારપૂર્વક રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.